

હિંમતનગર ખાતેની મજૂર અદાલતના કર્મચારી વળતર ધારા
હેઠળ નિમાયેલ કમિશનર શ્રી ડી.જે. ચૌહાણ સમક્ષ.મું
હિંમતનગર

ડબલ્યુ સી. પરચુરણ અરજી નં. ૮/૨૦૧૧
 ઈન

કામદાર વળતર નોન ફેટલ અરજી નં. ૨/૧૯૯૮

આંક-૩૪

અરજદાર: રમણભાઈ નરસિંહભાઈ પટેલ

રહે. રાજપુર તા. ધનસુરા

જી. અરવલ્લી

વિરુદ્ધ

- સામાવાળા:** (૧) યશ કન્ટ્રક્શનના માલિક અને પ્રોપરાઈટરશ્રી
 જગેશચંન્દ્ર રાણા, શ્રી યોગેશચંન્દ્ર રાણા
 રોડ કોન્ટ્રાક્ટર અને એન્જીનીયર,
 સહજાનંદ શોપીંગ સેન્ટર શાહીબાગ રોડ,
 અમદાવાદ (આંક-૧૫ ના હુકમથી ડીલીટ કરેલ છે)
- (૨) વી.બી.શાહ એન.કે. એસ્ટેટ
 સરખેજ, અમદાવાદ
- (૩) યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિ.
 સીટી બ્રાન્ચ, અમદાવાદ

હાજર રહ્યા::-

અરજદાર તરફે	:	વિ.વ.શ્રી કે.આર. પટેલ
સામાવાળા નં.૧ તરફે	:	વિ.વ.શ્રી બી.આર. પટેલ
સામાવાળા નં.૨ તરફે	:	ગેરહાજર
સામાવાળા નં.૩ તરફે	:	વિ.વ.શ્રી જી.કે. ભાવસાર

::- હુકમ :-

- (૧) સદર અરજી આ કામના અરજદારે કામદાર વળતર ધારો-૧૯૨૩ જે હવે કર્મચારી વળતર ધારા તરીકે ઓળખાય છે (કે જેને હવે પછી કાયદા તરીકે ઉલ્લેખવામાં આવશે.)ની કલમ-૩૧ હેઠળ દાખલ કરી કામદાર વળતર નોન ફેટલ અરજી નં.૨/૧૯૯૮ માં તા.૨૭/૧૨/૨૦૦૭ ના રોજ થયેલા હુકમ મુજબની વળતર અને તા. ૬/૧૨/૯૬ થી તા. ૬/૩/૨૦૧૧ સુધીના વ્યાજની રકમ મળી કુલ રકમ રૂ. ૧,૯૧,૫૫૪/- સામાવાળા નં.૧ થી ૩ પાસેથી વસુલ અપાવવા દાદ માંગેલી છે.
- (૨) અરજદારની અરજીની વિગત ટુંકમાં એવી છે કે, તેઓ સામાવાળા નં.૧, ૨ ને ત્યાં ડ્રાઈવર તરીકે ફરજો બજાવતા હતા અને સામાવાળાની માલિકીના ડમ્પર નં. જી.જે. ૧ એક્સ ૩૦૫૦ પર ફરજ બજાવતા દરમ્યાન તેમને અકસ્માત થતાં ગંભીર ઈજાઓ થયેલી. જેના વળતર માટે વર્કમેન અરજી નં. ૨/૯૮ તા. ૩/૨/૯૮ ના રોજ કરેલી જેમાં તા. ૨૭/૧૨/૨૦૦૭ ના રોજ તેમના લાભમાં હુકમ થયેલો અને સામાવાળા નં.૧ થી ૩ ને વળતરની રકમ રૂ. ૮૩,૭૦૫/- ૯% ના ચઢતા વ્યાજ સહિત સંયુક્ત અને વિભક્ત રીતે ચુકવી આપવા જવાબદાર ઠરાવવામાં આવેલા. જ્યારે સામાવાળા નં.૧, ૨ ને વળતરની રકમની ૫૦% રકમ રૂ. ૪૧,૮૫૨/- ચુકવી આપવા જવાબદાર ઠરાવવામાં આવેલા. સામાવાળાઓએ હુકમ મુજબ વળતર, વ્યાજ અને પેનલ્ટીની રકમ ચુકવેલ ન હોવાથી માંગ્યા મુજબની રકમ તેઓ પાસેથી વસુલ અપાવવા જણાવેલું છે.
- (૩) આ કામે સામાવાળા નં.૧ ને નોટિસ બજતાં તેઓ તરફે વિ. એડવોકેટશ્રી ભાવિન આર. પટેલ હાજર થયા બાદ સામાવાળા નં.૧ તરફે પેનલ્ટીની રકમ અરજદારને ચુકવી આપવામાં આવેલ હોવાથી તેઓ સદર રકમ લેવા માંગતા ન હોવાથી સામાવાળા નં.૧ ને સદર કેસમાંથી ડીલીટ કરવા અરજદારે આંક-૧૫ ની પુરસીસથી જણાવેલ જે અન્વયે હુકમ કરી સામાવાળા નં.૧ ને આ કામેથી પક્ષકાર તરીકે ડીલીટ કરવામાં આવેલા

છે. સામાવાળા નં.૨ ની નોટિસ અનકલેઈમ થયેલ છે. મુળ વળતર અરજીનો હુકમ જોતાં તેમાં કોઈ હુકમ સામાવાળા નં.૨ વિરુદ્ધ થયેલો નથી.

- (૪) સામાવાળા નં.૩ વીમા કંપનીને આંક-૪ ની નોટિસ રજી. એડીથી બજાવવામાં આવેલી છે. ત્યારબાદ ફરીથી તેઓને આંક-૧૬ ની નોટિસ અને આંક-૧૮ ની નોટિસ રજી.એડીથી બજાયા બાદ આંક-૨૧ થી એડવોકેટશ્રી જી.કે.ભાવસાર હાજર થયેલા છે. ત્યારબાદ પણ કોઈ જવાબ રજુ ન થતાં ફરીથી આંક-૨૩ ની નોટિસ રજી. એડીથી વીમા કંપનીને બજાવવામાં આવેલી છે. વીમા કંપની તરફે જવાબ રજુ ન થતાં આંક-૨૬ હેઠળ હુકમ કરી તેમનો જવાબનો હકક બંધ કરવામાં આવેલો છે.
- (૫) આંક-૨૮ થી અરજદારે એફિડેવીટ ઉપર જુબાની આપેલ છે. તેઓની ઉલટ માટે વીમા કંપની હાજર ન રહેતાં આંક-૩૦ હેઠળ હુકમ કરી અરજદારની ઉલટનો વીમા કંપનીનો હકક બંધ કરવામાં આવેલો છે. ત્યારબાદ આંક-૩૧ ની પુરસીસથી અરજદારે પોતાના પુરાવા બંધ જાહેર કરેલા છે.
- (૬) સામાવાળા નં.૩ વીમા કંપની તરફે કોઈ પુરાવો રજુ ન થતાં આંક-૩૨ હેઠળ હુકમ કરી તેમનો પુરાવા રજુ કરવાનો હકક બંધ કરવામાં આવેલો છે.
- (૭) અરજદાર તરફે તેમના વિ. એડવોકેટશ્રી કે.આર.પટેલે મૌખિક દલીલો કરેલી છે. સામાવાળા તરફે દલીલો માટે મુદત લીધા બાદ પણ કોઈ હાજર ન રહેતાં તેમનો દલીલોનો હકક બંધ કરી કેસ હુકમ પર લેવામાં આવેલો છે.
- (૮) દલીલ ધ્યાને લીધી. રેકર્ડ વંચાણો લીધુ. મારા નિર્ણય અર્થે નીચે મુજબના મુદ્દા ઉપસ્થિત થાય છે.

મુદા:-

- (૧) શું અરજદારે અરજીથી માંગ્યા મુજબની વળતર, વ્યાજ અને ખર્ચની રકમ અંગે સામાવાળા નં.૩ વિરુદ્ધ રીકવરી સર્ટિફિકેટ કાઢવા હુકમ કરવો જોઈએ ?

(૨) શું હુકમ ?

(૯) ઉપરોક્ત મુદ્દાઓના મારા નિર્ણય નીચે મુજબ છે

(૧) હકારમાં.

(૨) આખરી હુકમ મુજબ.

(૧૦) મારા નિર્ણયના કારણો નીચે મુજબ છે.

(એ) આ કામે અરજદારે આ અરજી કર્મચારી વળતર ધારો. ૧૯૨૩ ની કલમ-૩૧ હેઠળ કરેલી છે. જે નીચે મુજબ છે.

Sec. 31 Recovery:-

The commissoner may recover as an arrear of land- revenue any amout payable by any person under this Act, whether under an agreement for the payment of compensation or otherwise, and the Commissioner shall be deemed to be a public officer within the meaning of section 5 of the Revenue Recovery Act, 1890 (1 of 1890)

ઉપરોક્ત કલમ વંચાણે લેતાં શ્રમયોગી કાયદા હેઠળ લેણી નીકળતી રકમ વસુલ લેવા માટે માલિક વિરુદ્ધ અરજી કરી શકે છે અને કમિશ્નર સદર રકમની વસુલાત માટે રીકવરી સર્ટિફિકેટ ઈસ્યુ કરી તેની વસુલાત કરાવી શકે છે.

ઉપરોક્ત ધ્યાને રાખી રેકર્ડ જોતાં અરજદારે આ અરજી કામદાર વળતર નોન ફેટલ અરજી નં. ૨/૯૮ માં તા. ૨૭/૧૨/૨૦૦૭ ના રોજ થયેલા હુકમ મુજબ વીમા કંપની પાસેથી લેણી પડતી વળતરની રકમ રૂ. ૮૩,૭૦૫/- અકસ્માત તારીખ ૬/૧૨/૯૬ થી તા. ૬/૩/૧૧ સુધીના સમયગાળાના ૯ % વ્યાજ સહિત થતી રકમ રૂ. ૧,૯૧,૫૫૪/- અને ૧,૦૦૦/- રૂ. ખર્ચની રકમ વસુલ અપાવવા દાદ માંગતી કરેલી છે. અરજદારે હુકમ મુજબની પેનલ્ટીની રકમ સામાવાળા નં.૧, ૨ પાસેથી વસુલ માંગેલ પણ પેનલ્ટીની રકમ તેઓને ચુકવવામાં આવતાં અરજદારે સામાવાળા નં.૧ ને આ કામેથી ડીલીટ કરેલ છે.

અરજદારે આંક-૨૯ ની એફિડેવીટ થી હુકમ મુજબની રકમ તેઓને મળેલ ન હોવાનું અને વીમા કંપનીને વારંવાર જણાવવા છતાં તેઓએ કોઈ રકમ ભરપાઈ કરેલી ન હોવાથી લેણી રકમ અંગે વીમા કંપની વિરુદ્ધ રીકવરી સર્ટિફિકેટ કાઢી આપવા જણાવેલું છે. અરજદારની આ સોગંદ પરની રજુઆતને વીમા કંપની દ્વારા ઉલટ કરી પડકારવામાં આવેલ નથી. વીમા કંપનીએ અરજદારની અરજીનો કોઈ જવાબ રજુ કરેલ નથી કે કામદાર વળતર નોન ફેટલ અરજી નં. ૨/૯૮માં થયેલા હુકમનું તેમણે પાલન કરેલું હોય કે તે હુકમને નામદાર હાઈકોર્ટ સમક્ષ પડકારેલ હોય કે રદ કરાવેલ હોય કે તેના અમલને અટકાવેલ હોય તેવો કોઈ પુરાવો રજુ કરેલો નથી. જેથી વળતર અરજીમાં થયેલા હુકમ આધારે અરજદારે અરજીથી માંગ્યા મુજબની રકમ સામાવાળા નં.૩ પાસેથી લેણી પડતી હોવાનું સ્પષ્ટ સાબિત થતું હોઈ સદર રકમની વસુલાત માટે સામાવાળા નં.૩ વિરુદ્ધ રીકવરી સર્ટિફિકેટ કાઢવા હુકમ કરવો વ્યાજબી જણાય છે. વીમા કંપનીએ અરજદારે રજુ કરેલ વ્યાજબી ગણતરીને પણ આ કામે પડકારેલ નથી. જેથી વળતરની રકમ રૂ. ૮૩,૭૦૫/- ઉપર તા. ૬/૧૨/૯૬ થી તા. ૬/૩/૧૧ ના સમયગાળાનું ૯% લેખે વ્યાજ સહિત થતી રકમ રૂ. ૧,૯૧,૫૫૪/- અને વળતર અરજીના ખર્ચની રકમ રૂ. ૧,૦૦૦/- મળી રૂ. ૧,૯૨,૫૫૪/- નું રીકવરી સર્ટિફિકેટ સામાવાળા નં.૩ વિરુદ્ધ કાઢવા હુકમ કરવો વ્યાજબી જણાય છે.

(બી) સામાવાળા નં.૩ દ્વારા વળતર અરજીના હુકમ મુજબની લેણી રકમ અરજદારને ચુકવી આપવામાં આવેલી ન હોઈ અરજદારને આ અરજી કરવી પડેલ હોઈ અરજી ખર્ચની રકમ રૂ. ૨,૦૦૧/- પણ અરજદારને ચુકવી આપવા સામાવાળા નં.૩ વિરુદ્ધ હુકમ કરવો વ્યાજબી જણાય છે. જેથી મુદ્દા નંબર :૧ નો જવાબ હકારમાં આપવામાં આવે છે.

(૧૧) જેથી કેસનું રેકર્ડ તથા કાયદાની પરિસ્થિતિ લક્ષમાં લઈ ન્યાયના હિતમાં નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.

—: હુકમ:—

(૧) આથી આ કામના સામાવાળા નં.૩ વીમા કંપની વિરુદ્ધ વળતરની રકમ રૂ. ૮૩,૭૦૫/— ઉપર તા. ૬/૧૨/૯૬ થી તા. ૬/૩/૧૧ સુધીના સમયગાળાની ૯% લેખે વ્યાજની થતી રકમ રૂ. ૧,૯૧,૫૫૪/— અને વળતર અરજીના ખર્ચની રકમ રૂ. ૧,૦૦૦/— તથા આ અરજી ખર્ચની રકમ રૂ. ૨,૦૦૧/— મળી કુલ રકમ રૂ. ૧,૯૪,૫૫૫/— ની વસુલાત કરી સદર રકમ અત્રેની કચેરીમાં જમા કરાવવા સારું રીકવરી સર્ટિફિકેટ ઇસ્યુ કરી તેની અમલ બજવણી માટે સક્ષમ ઓથોરિટીને મોકલી આપવા ન્યાયના હિતમાં હુકમ કરવામાં આવે છે.

(૨) આ હુકમની જાણ થયાના દિન-૩૦ માં વીમા કંપની હુકમ મુજબની રકમ જમા ન કરાવે તો રીકવરી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું રહેશે.

સ્થળ: હિંમતનગર કટિ
તારીખ:—૧૨/૦૭/૨૦૧૮
P.T.Prajapati..

ટિપકકુમાર જયંતિલાલ ચૌહાણ)
જીજે-૦૦૭૮૦
કમિશનર,
કર્મચારી વળતર ધારો
મજુર અદાલત, હિંમતનગર